

RBO-III/BD/2024-25/

Date-06.09.2024

પ્રતિશ્રી,
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી,
પ્રાથમિક શિક્ષણ કચેરી,
જિલ્લા - જામનગર
જામનગર

રાજ્ય સરકારના પગાર પેકેજ (SGSP) હેઠળ શાળાના શિક્ષકોના પગારખાતાઓ માટે સમજૂતીપત્ર:
(MOU).

સાહેબશ્રી,

ઉપરોક્ત સંદર્ભમાં, અમને જણાવતા આનંદ થાય છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ રાજ્ય સરકારના પગાર પેકેજ એકાઉન્ટ્સ હેઠળ શાળાના શિક્ષકોને લાભો આપવા માટે સમજૂતીપત્ર (MoU) માં પ્રવેશ કર્યો છે. બેંકે ગુજરાત રાજ્ય ના કાયમી શિક્ષકો માટે અનેક લાભો અને સુવિધાઓનો સમાવેશ કર્યો છે.

રાજ્ય સરકારના પગાર પેકેજ ખાતાઓની કેટલીક મહત્વપૂર્ણ સુવિધાઓ નીચે મુજબ છે:

- ❖ મફત વ્યક્તિગત અકસ્માત વિમા (મૃત્યુ) કવર રૂ. 40 લાખ.
- ❖ મફત કાયમી સંપૂર્ણ અશક્તતા કવર રૂ. 40 લાખ.
- ❖ મફત કાયમી આંશિક અશક્તતા વિમા કવર રૂ. 40 લાખ.
- ❖ મફત હવાઈ અકસ્માત વિમા (મૃત્યુ) કવર રૂ. 100 લાખ.
- ❖ એટીએમ કાર્ડ પર રૂ. 5 લાખ સુધીની વધારાની વ્યક્તિગત અકસ્માત વિમા (મૃત્યુ) કવર.
- ❖ રૂ. 10 લાખ સુધીના વધારાના હવાઈ અકસ્માત વિમા (મૃત્યુ) કવર.
- ❖ શૂન્ય બેલેન્સ (કોઈ ન્યૂનતમ બેલેન્સ જરૂરી નથી).
- ❖ લોકર ચાર્જમાં છૂટ.
- ❖ એટીએમ ઇશ્યુઅન્સ અને વાર્ષિક જાળવણી માટે કોઈ ચાર્જ નથી.
- ❖ ઓટો સ્વીપ સુવિધા
- ❖ એસબીઆઈમાં સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન માટે કોઈ ચાર્જ નથી.
- ❖ મફત મસ્ટી સિટી ચેક, NEFT/RTGS સુવિધા, SMS એલર્ટ્સ સુવિધા, ડીમાન્ડ ડ્રાફ્ટ ઇશ્યુઅન્સ
- ❖ એસબીઆઈ એટીએમ અને અન્ય બેંકોના એટીએમ પર મફત અનલિમિટેડ ટ્રાન્ઝેક્શન
- ❖ ફેમિલી બેન્કિંગ ફેસિલીટી - એસબીઆઈ રીસ્ટે ગોલ્ડ અને ઉપરના વેરીએન્ટ માટે
- ❖ હોમ લોન, નવી કાર લોન અને વ્યક્તિગત લોન પર વિશેષ વ્યાજ દરમાં છૂટ
- ❖ ક્રેડિટ કાર્ડ, ફોરેન ટ્રાવેલ કાર્ડ, પીપીએફ એકાઉન્ટ, એનપીએસ એકાઉન્ટ અને સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ
- ❖ એસબીઆઈ ડિમેટ એકાઉન્ટ, એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઈ અને જનરલ ઇન્શ્યોરન્સ
- ❖ અન્ય લાભો જે સામાન્ય બચત બેંક ખાતાધારકો માટે લાગુ પડે છે/ઉપલબ્ધ છે.


પગાર પેકેજ ખાતાઓની વિગતો પર અમારા ટીમ દ્વારા કોઈપણ અનુકૂળ સમય અને સ્થળ પર તમારા સ્ટાફને SGSP હેઠળની સુવિધાઓ અને લાભોની જાણ કરવા માટે એક ઔપચારિક પ્રસ્તુતિ (Presentation) આપવામાં આવશે.

અમે અન્ય મૂલ્યવર્ધક પ્રસ્તાવો માટે પણ કામ કરી રહ્યા છે જેમ કે:

- કોર્પોરેટ સેવેરી રિવેશનશિપ મેનેજર (CSRM) ની નિમણૂક "સિંગલ પોઈન્ટ સંપર્ક" તરીકે વ્યૂહાત્મક શાખાઓ પર.
- તમારા પગાર પ્રશાસન માટે, જો જરૂરી હોય તો, બલ્ક અપલોડ ફાઈલો દ્વારા "હેન્ડ-હોલ્ડિંગ" સપોર્ટ વધારવું.

અમે સ્કૂલ શિક્ષકો/કર્મચારીઓ માટે ઉપલબ્ધ વિગતવાર સુવિધાઓ અને લાભો સાથે અનુબંધક (Annexure) સામેલ કરીએ છીએ અને તમારી સાથે લાંબા અને પરસ્પર ફાયદાકારક સંબંધની અપેક્ષા રાખીએ છીએ.

આપનો વિશ્વાસુ,



સહાયક મહાપ્રબંધક (જામનગર)

જોડાણ : ઉપર મુજબ



SBI સ્ટેટ ગવર્મેન્ટ સેવેરી પેકેજ



વેરીએન્ટ	સિલ્વર	ગોલ્ડ	ડાયમંડ	પ્લેટિનમ
પગાર ધોરણ	₹10,000 - ₹25,000	> ₹ 25,000 - ₹50,000	> ₹ 50,000 - ₹1,00,000	> ₹ 1,00,000
મિનિમમ બેલેન્સ આવશ્યકતા	શૂન્ય			
વ્યક્તિગત અકસ્માત વીમો બેલેન્સ શૂન્યહોય તો પણ સક્રિય ખાતા માટે ઉપલબ્ધ	₹40 લાખ			
પરમેનેન્ટ ટોટલ ડિસિબિલિટી	₹40 લાખ			
પરમેનેન્ટ પાર્સિયલ ડિસીબિલિટી કવર	₹40 લાખ			
હવાઈ દુર્ઘટના વીમો એર ટિકિટ SBI ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગ થી ખરીદી પર	₹ 1 Crore			
ડેબિટ કાર્ડ પર વધારાનો અકસ્માત વીમો (Visa/Master)	કશું નહીં	₹2 લાખ	₹2 લાખ	₹5 લાખ
ડેબિટ કાર્ડ પર વધારાનો હવાઈ દુર્ઘટના વીમો(Visa/Master)	કશું નહીં	₹4 લાખ	₹4 લાખ	₹10 લાખ
ડેબિટ કાર્ડ પર ખરીદ પ્રોટેક્શન કવર	₹2 લાખ			
વધારાનો અકસ્માત વીમો Ru-Pay પ્લેટિનમ ડેબિટ કાર્ડ પર	₹10 લાખ			
બે મહિનાના ચોખ્ખા (નેટ) પગાર સુધીનો સરળ ઓવર ડ્રાફ્ટ	કશું નહીં	મહત્તમ મર્યાદા ₹ 0.75 લાખ	મહત્તમ મર્યાદા ₹ 1.5 લાખ	મહત્તમ મર્યાદા ₹2 લાખ
લોકર ચાર્જમાં છૂટ	કશું નહીં	કશું નહીં	15%	25%
PAI માં સમાવિષ્ટ કવર્સ પર વધારાનો વીમો (આકસ્મિક મૃત્યુ પર પાત્ર દાવાઓના કિસ્સામાં લાગો)	-પ્લાસ્ટિક સર્જરી બર્ન કેસ નો ખર્ચ 10 લાખ રૂપિયા સુધી -બાળકના ઉચ્ચ શિક્ષણ ખર્ચ સ્નાતક માટે પુરુષ બાળક માટે 8 લાખ રૂપિયા સુધી અને છોકરી માટે 10 લાખ રૂપિયા (ઉંમર 18 થી 25 વર્ષ) -કન્યાના લગ્ન માટે (ઉંમર 18 થી 25 વર્ષ) બે છોકરી માટે 10 લાખ એક છોકરી માટે પાંચ લાખ -ફરજો બજાવતા 10 લાખનું વધારાનું કવર (રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિ આંતકવાદી નક્ષલવાદી વિદેશી દુશ્મન નો હુમલા ના કેસ માં) -પાંચ લાખ રૂપિયા સુધીનો આયાતી દવા પર નો ખર્ચ -અકસ્માતમાં કોમા પછી મૃત્યુ 48 કલાકથી વધુ પાંચ લાખ રૂપિયા સુધી -એર એમ્બ્યુલન્સ 10,00 સુધીનું કવર -પરિવારના બે સભ્યો માટે અકસ્માતના સ્થળે પહોંચવા માટે કૌટુંબિક પરિવહન ખર્ચ 50,000 સુધી -એમ્બ્યુલન્સ ચાર્જ 50000 રૂપિયા સુધી			
ચાર્જિસ ફ્રી ખાતા	-એન.ઈ.એફ.ટી / આર.ટી.જી.એસ. ઓનલાઇન ફ્રી -મલ્ટી સીટી ચેક-25 પાના દર મહિને -સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન ફ્રી -અનલિમિટેડ ફ્રી ડિમાન્ડ ડ્રાફ્ટ			
એટીએમ કાર્ડ પર ઉપાડ નીમર્યાદા	મહત્તમ મર્યાદા ₹20,000/-પર દિવસ	મહત્તમ મર્યાદા ₹50,000/- પરદિવસ	મહત્તમ મર્યાદા ₹50,000/-પર દિવસ	મહત્તમ મર્યાદા ₹1,00,000/-પર દિવસ



એટીએમ કાર્ડ પર નંબર ઓફ ટ્રાન્ઝેક્શન લિમિટ	અનલિમિટેડ ફી (બધા જ બેંકના એટીએમ પર)
ઓટો સ્વીફ્ટ ફેસીલીટી	ઉપલબ્ધ છે
લોન પર ઓફર	-હોમ લોન નવી કાર લોન અને વ્યક્તિગત લોન પર વિશેષ વ્યાજ દરમાં છૂટ, -પ્રોસેસિંગ ફી પર 50 % થી 100 % સુધીની છૂટ -કાર લોન પર LTV 100% સુધી ધિરાણ - સમયાંતરે, બેન્ક દ્વારા વ્યાજદર / પ્રોસેસિંગ ચાર્જ માં રાહત.
ફેમિલી બેન્કિંગ ફેસીલીટી એસબીઆઇ રીસ્ટે ગોલ્ડ અને ઉપરના વેરીએન્ટ માટે	-ચાર પરિવારના સભ્યોના ઝીરો બેલેન્સ એકાઉન્ટ -ફ્રી ડેબિટ કાર્ડ અને કોઈ વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ નહીં -તમામ બેંકના એટીએમ પર આ મર્યાદિત વ્યવહાર -ફ્રી એસએમએસ એલર્ટ, અમર્યાદિત DD, દર મહિને 25 પાનાની ચેકબુક ફ્રી -પરિવારના સભ્યો માટે લોકરના ચાર્જ માં 10% સુધીની છૂટ -પરિવારના સભ્યોને પાંચ લાખ રૂપિયા સુધીના વ્યક્તિગત અકસ્માત વીમો (સગીર સિવાય)
તમામ જરૂરિયાતો માટે તમારે માત્ર એક જ બેંકની જરૂર છે	-ક્રેડિટ કાર્ડ / ફોરેન ટ્રાવેલ કાર્ડ / પીપીએફ એકાઉન્ટ / એનપીએસ એકાઉન્ટ/ સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ -એસબીઆઇ ડિમેટ એકાઉન્ટ /એસબીઆઇ મ્યુચ્યુઅલ ફંડ / એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સ, એસબીઆઇ
હેલ્થ વીમો* સંપૂર્ણ આરોગ્ય	SBI જનરલ *સંપૂર્ણ આરોગ્ય* • પરિવારમાં સ્વયં, પતિ/પત્ની, 2 બાળકો • હોસ્પિટલાઇઝેશન; ક્રિટિકલ ઇલેન્સ; દૈનિક હોસ્પિટલ રોકાણ • હોસ્પિટલાઇઝેશન કવર: બધા પ્લાન માટે ઉપલબ્ધ. • દૈનિક હોસ્પિટલ રોકાણ: બધા પ્લાન માટે ઉપલબ્ધ* પ્લાન: વીમા રકમ • સ્ટાન્ડર્ડ: ₹ 1/2/3/4/5 લાખ • ક્લાસિક: ₹ 2/3/4/5 લાખ • સુપર: ₹ 2/3/4/5 લાખ • અલ્ટ્રા: ₹ 6/7/8/9/10 લાખ સામાન્ય રૂમ માટે 2% અને ICU માટે 4% બધા 4 પ્લાન માટે. અલ્ટ્રા પ્લાન માટે OPD કવર: વીમા રકમનો 1%, વધુમાં વધુ ₹10,000; ડિસ્ક્રેબલ - ₹500 અલ્ટ્રા પ્લાન માટે પુનઃસ્થાપન લાભ: અન્ય બીમારીઓ માટે 100% વીમા રકમ પુનઃસ્થાપિત

સ્વયં હેલ્થ વીમો (Self) 1A				
	ઇન્સ્યોરન્સ રકમ 1 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 2 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 3 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 5 લાખ
18-35	1805	2784	3538	4395
36-45	2375	3703	4732	5888
46-55	3025	4760	6117	7617
56-60	4651	7358	9491	11817
61-65	6068	9629	12444	15495
પરિવારના સભ્યો માટે હેલ્થ વીમો (Self+Family) 2A+2C				
	ઇન્સ્યોરન્સ રકમ 1 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 2 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 3 લાખ	ઇન્સ્યોરન્સ રકમ 5 લાખ
18-35	4947	7706	9813	12239
36-45	5465	8560	10935	13647
46-55	6755	10687	13730	17154
56-60	8784	14033	18126	22668



61-65	11159	17950	23274	29125
-------	-------	-------	-------	-------

અન્ય જરૂરી માહિતી

- એકાઉન્ટ ખોલાવવા માટે ફક્ત આધાર કાર્ડ, પાન કાર્ડ, સેલેરી સ્લીપ અને 2 ફોટોસ જરૂરી છે. SBI સ્ટાફ દ્વારા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરી ફોર્મ ભરી આપવામાં આવશે. બ્રાન્યમાં આવવું ફરજિયાત નથી.
- નવું સેલેરી ખાતું પેહલા જ દિવસથી સ્ટેટ ગવર્મેન્ટ સેલેરી પેકેજ માં ખોલવામાં આવે છે. કોઈ પણ એકાઉન્ટના પ્રોડક્ટ કોડની વિગત પાસબુક અને YONO મોબાઈલ એપ્લિકેશનથી જોઈ શકાય છે.
- SBI બેન્કમાં પર્સનલ લોન એકદમ સરળતાથી ઉપલબ્ધ. રૂ.8 લાખ સુધીની પ્રિ-અપ્પ્રુવ્ડ ડિજિટલ લોનની સુવિધા જેમાં એક પણ ડોક્યુમેન્ટ કે સાઇન વગર ફક્ત 5 જ મિનિટમાં લોનની રકમ ખાતામાં જમા થઈ જાય છે. લોન લેતી વખતે કોઈ પણ ગેરેન્ટરની જરૂર પડતી નથી

ભારતની સૌથી મોટી અને સૌથી મજબૂત સરકારી બેન્કનો ભરોસો. તમારી રકમ અમારી પાસે એકદમ સુરક્ષિત છે

વધુ માહિતી અને જાણકારી માટે SBIની કોઈ પણ શાખા / રિજીયન ઓફિસનો (89801 20012/ 76000 43709) સંપર્ક કરવા વિનંતી.

